



RAN-2408000604030005

S.Y.B.Com. (Sem.-IV) Examination October - 2025 Banking Law and Practice Paper - III (Minor)

Time: 2 Hours]

[Total Marks: 50

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book
- (2) જમણી બાજુના આંકડા પ્રશ્નનાં ગુણ દર્શાવે છે.
- (3) Figures to the right indicate full marks of the question.

Seat No.:

Student's Signature

Q.1. નીચેના પ્રશ્નોનાં ટુંકમાં જવાબ આપો. (કોઈપણ પાંચ)

10

Answer the following question in brief. (Any five)

10

1. બેન્ક તરલતા એટલે શું?
What is meant by bank liquidity?
2. એડવાન્સિસનો અર્થ શું છે?
What is the meaning of advances?
3. ચેકનો અયોગ્ય નકાર કોને કહેવાય?
What is called dishonour of a cheque?
4. કાસા (CASA) ડિપોઝિટના અર્થ જણાવો.
State the meaning of CASA deposit.
5. કાસા ડિપોઝિટમાં ચાલુ ખાતાની વિશેષતાઓ જણાવો.
State the features of current account in Casa deposit.
6. કાસા (CASA) ડિપોઝિટનું સુત્ર આપો.
Give the formula of CASA deposit.
7. મુખ્ય હકીકત પત્રક (કી ફેક્ટ સ્ટેટમેન્ટ) ની વ્યાખ્યા આપો.
Give the definition of the Key Fact Statement.

Q.2. બેંકરે ચેકના નાણાં ચૂકવતા પહેલા કઈ સાવચેતીઓ રાખવી જોઈએ? સમજાવો.

14

Explain what precautions a banker should take before making the payment of a Cheque.

14

અથવા / OR

Q.2.અ. ચેકના નાણા ચૂકવનાર બેન્કરને આપવામાં આવતું રક્ષણ સમજાવો.

7

Explain the protection given to the banker who pays the money of a Cheque.

7

બ. સિબિલ સ્કોરની વિવિધ શ્રેણીઓ વર્ણવો.

7

Describe the various series of CIBIL score.

7

- Q.3.** કાસા (CASA) ખાતા ધારકો માટે બેંકો દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ અને ચેનલો સમજાવો. **14**
 Explain the services and channels offered by banks for CASA account holders. **14**
અથવા / OR
- Q.3.અ.** બેંકો માટે કાસા (CASA) ડિપોઝિટનું મહત્વ વર્ણવો **7**
 Describe the importance of CASA for bankers. **7**
- બ.** બેંકો માટે સિબિલ (CIBIL) સ્કોરનું મહત્વ સમજાવો. **7**
 Explain the importance of the CIBIL score for banks **7**
- Q.4.અ.** ટુંકનોંધ લખો (ગમે તે એક) **6**
 1. વાર્ષિક ટકાવારી રેટ (APR)
 2. ક્યારે બેંક ચેકના નાણાં ચુકવવાનો ઇનકાર કરી શકે?
- A. Write a short note : (Any one)** **6**
 1. Annual Percentage Rate (APR).
 2. When a banker is justified in refusing payment?
- બ. નીચેના સંજોગોમાં બેન્કર તરીકે તમે શું કરશો?** **6**
 1. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરુચ નો એક ગ્રાહક જે સરકારી કર્મચારી છે. જે હાઉસિંગ લોન લેવા માટે બેંકમાં અરજી કરે છે. બેંકમાં લોનની કાર્યવાહી કરવા માટેનાં જરૂરી દસ્તાવેજો પણ આપે છે. બેન્કર તરીકે તમે લોન મંજૂર કરવા કયા પ્રકારનાં સિબિલ સ્કોરનો અભ્યાસ કરશો/ શા માટે?
 2. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો કોઈ એક ગ્રાહક મોબાઈલ ફોન દ્વારા ચેકનું સ્ટોપ પેમેન્ટ કરવા જણાવે છે.
- B. What would you do as a banker in the following circumstances?** **6**
 (1) A customer of State Bank of India Bharuch who is a government employee who applies to the bank for a housing loan. He also provides the necessary documents to process the loan in the bank. As a banker, what kind of CIBIL score will you study to approve the loan? Why?
 (2) One of the customers of the State Bank of India asks to stop payment of a cheque by mobile phone.